

Prime Minister Shri Narendra Modi virtually met stakeholders involved in Operation Ganga launched for evacuation of Indians from Ukraine

March 15, 2022

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી યુક્રેનમાંથી ભારતીયોને બહાર લાવવા માટે શરૂ કરવામાં આવેલા ઓપરેશન ગંગામાં સામેલ હિતધારકોને વર્ચ્યુઅલ રીતે મળ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ઓપરેશન ગંગામાં સામેલ હિતધારકો સાથે વાતચીત કરી હતી. ઓપરેશન ગંગાએ લગભગ 23000 ભારતીય નાગરિકો તેમજ 18 દેશોના 147 વદિશી નાગરિકોને યુક્રેનમાંથી સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા.

વાર્તાલાપ દરમિયાન, યુક્રેન, પોલેન્ડ, સ્લોવાકિયા, રોમાનિયા અને હંગેરીમાં ભારતીય સમુદાય અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓએ ઓપરેશન ગંગાનો ભાગ બનવાના તેમના અનુભવો, તેઓએ જે પડકારોનો સામનો કર્યો હતો તે વર્ણવ્યા હતા અને એક જટિલ માનવતાવાદી કામગીરી માટે આવા યોગદાન બદલ સંતોષ અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયના નેતાઓ, સ્વયંસેવક જૂથો, કંપનીઓ, ખાનગી વ્યક્તિઓ અને સરકારી અધિકારીઓ માટે તેમની ઉષ્માભરી પ્રશંસા વ્યક્ત કરી જેમણે ઓપરેશનની સફળતા માટે અથાક મહેનત કરી હતી. તેમણે ઓપરેશન ગંગામાં સામેલ તમામ હિતધારકો દ્વારા પ્રદર્શિત કરાયેલ દેશભક્તિના ઉત્સાહ, સમુદાય સેવાની ભાવના અને ટીમ-સ્પિરિટની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ખાસ કરીને વિવિધ સામુદાયિક સંસ્થાઓની પ્રશંસા કરી હતી અને નર્દેશ કર્યો હતો કે તેમની નિઃસ્વાર્થ સેવા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું ઉદાહરણ આપે છે જેને તેઓ વદિશી દરખાકાઈ પણ મૂલ્યમિત કરે છે.

કટોકટી દરમિયાન ભારતીય નાગરિકોની સુરક્ષા સુનશ્ચિતિ કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો વધી બોલતા, પ્રધાનમંત્રીએ યુક્રેન અને તેના પડોશી દેશોના નેતાઓ સાથેની તેમની વ્યક્તિગત વાતચીતને યાદ કરી અને તમામ વદિશી સરકારો તરફથી મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.

વદિશમાં ભારતીયોની સુરક્ષાને સરકાર જે ઉચ્ચ પ્રાથમિકતા આપે છે તેનો પુનરોચ્ચાર કરતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે કોઈપણ આંતરરાષ્ટ્રીય કટોકટી દરમિયાન ભારતે હંમેશા તેના નાગરિકોને મદદ કરવા માટે તત્પરતાથી કામ કર્યું છે. વસુધૈવ કુટુંબકમની ભારતની વર્ષો જૂની ફિલિસૂફી દ્વારા સંચાલિત, ભારતે કટોકટી દરમિયાન અન્ય દેશોના નાગરિકોને પણ માનવતાવાદી સમર્થન આપ્યું છે.

નવી દલિહી

15 માર્ચ, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.